

October 30, 2021

To,  
Department of Corporate Services,  
BSE Limited  
Ground Floor, P.J.Tower,  
Dalal Street, Fort,  
Mumbai- 400001

**BSE Script Code: 541735**

Dear Sir/Madam,

**Sub.: Intimation under Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015**

In terms of Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copy of newspaper advertisement published in English daily newspaper (Freepress Journal) and one daily newspaper (Lokmitra) in Gujarati language of the region, where the registered office of the company is situated for extract of Unaudited Standalone & Consolidated Financial Results for the Quarter ended September 30, 2021.

Please take the same on your record.

Thanking you,  
Yours Faithfully,

**For, Vivanta Industries Limited**

*K. A. Parekh*

**Kuldip Parekh**  
CFO  
PAN: BFDPP4709J



Encl: As above

CIN : L74110GJ2013PLC075393



**Rajasthan bypolls: Close fight and triangular contest in Vallabh Nagar, Dhariawad**

Jaipur, Rajasthan's two assembly seats going for bypolls this Saturday - Vallabh Nagar and Dhariawad have become political hotbeds, with parties putting in all their efforts to bring them in their kitty. The ministers and other leaders camping in for weeks, the CM addressing rallies twice, and the large presence of senior BJP leaders from Delhi and state has surprised the people of the constituencies with this attention. The bypolls have been necessitated due to the demise of BJP MLA from Dhariawad, Gautam Lal Meena, and Congress MLA from Vallabh Nagar, Gajendra Singh Shaktawat. Both the assemblies are facing a close contest with regional parties and independent candidates giving a tough time to the ruling Congress and Opposition BJP.

**Nikon Unveils the Latest UNSTOPPABLE Z 9**



Ahmedabad, A big change has arrived in the world of photography. Nikon India Private Ltd., 100% subsidiary of Nikon Corporation Tokyo, unveils the latest Nikon Z 9, the revolutionary full-frame (Nikon FX-format) Z series mirrorless camera designed to surpass expectations with its unrivalled performance and breakthrough features that are firsts for both in the

mirrorless category and in Nikon. Enhancing user capability, the introduction of the Z 9 allows professionals to capture stills and videos with ease. Nikon's first 4-axis vertical and horizontal tilting monitor and integrated vertical grip will have users capturing the best moments in comfort, even under the harshest conditions. The Z 9 also features the world's largest\* variety of simultaneous subject detection amongst mirrorless cameras, with its tenacious autofocus (AF) offering, and the Real-Time Viewfinder without blackout period. Users will be among the first to enjoy shooting with stunning 8K in-camera recording for up to 125 minutes for making it the most practical camera for location shoots. (1-7)

**ICRA upgrades rating of Asian Grano India Ltd with a stable outlook**



Ahmedabad, The rating agency ICRA Ltd has upgraded ratings of Asian Grano India Ltd with a stable outlook. The rating agency upgraded the long term rating to ICRA A+ (Stable) (pronounced ICRA A plus) from ICRA A (Stable) (pronounced ICRA A one). The rating was in connection with a Rs. 254.11 crore bank facilities of Asian Grano India Ltd. Outlook on the long term rating of the company is also stable. Instruments with ICRA A+ rating are considered to have adequate degree of safety regarding timely servicing of financial

obligations. Such instruments carry low credit risk. Instruments with ICRA A1 rating are considered to have very strong degree of safety regarding timely payment of financial obligations. Such instruments carry lowest credit risk. The Rating of its group entity - Crystal Ceramic Industries Pvt Ltd is upgraded to ICRA A+ (CE) (Stable) (pronounced ICRA A plus credit enhancement) from ICRA A (CE) (Stable) (pronounced ICRA A credit enhancement) for Rs. 106 crore bank facilities. Short term rating of Amazono Ceramics Ltd is reaffirmed at ICRA A1 (CE) (pronounced ICRA A one credit enhancement). Similarly, long term rating of Amazono Ceramics Ltd is upgraded to ICRA BBB+ (Stable) (pronounced ICRA triple B plus) from ICRA BBB (Stable) (pronounced ICRA triple B). Short term rating of ICRA A2 (pronounced ICRA A two) from ICRA A3+ (pronounced ICRA A three plus). (18-2)

**Prime Video to be the Exclusive Streaming Destination**



Ahmedabad, Prime Video India today announced an exclusive licensing deal with India's biggest production house Yash Raj Films (YRF) that will make the steaming service the home to the studio's four massively mounted upcoming theatrical releases. As part of this deal, Prime Video will have exclusive global streaming rights to these four most anticipated titles under the Yash Raj Films banner. Doubling down on its commitment to offer seamless access to the best movies to viewers from the safety and convenience of their homes, Prime Video will stream these titles just four weeks after their theatrical release.

Aur Babi 2 starring Saif Ali Khan, Rani Mukerji, Siddhant Chaturvedi, and the gorgeous debutant Sharvari; Ranbir Kapoor; Vaani Kapoor and Sanjay Dutt's mega-action entertainer Shashtra; historical action spectacle Prithviraj based on the life of fearless King Prithviraj Chauhan starring Akshay Kumar, Sanjay Dutt, Manushi Chhillar and Sonu Sood; Ranveer Singh's big ticket family entertainer with a powerful social message Jayeshbhai Joridar.

"At Prime Video, we are intensely focused on bringing the biggest & the best entertainment to our customers and this partnership with Yash Raj Films is the perfect demonstration of that commitment," said Gaurav Gandhi, country head, Prime Video India. (19-8)

**WR TO ISSUE SEASON TICKETS IN NOMINATED SPECIAL TRAINS OVER NON - SUBURBAN SECTIONS W.E.F**

Ahmedabad, For the convenience of passengers, it has been decided to issue Monthly Season Tickets (MST) in non - suburban sections of Western Railway in nominated Special trains with effect from 29th October, 2021. These passengers can avail the season ticket to travel in only unreserved coaches of these nominated Special trains.

- According to a press release issued by Shri Sumit Thakur - Chief Public Relations Officer of Western Railway, the details of Special trains along with the number of coaches to be run as unreserved are as under:-
1. Train No. 09011/09012 Mumbai Central - Ahmedabad Superfast Special running with 7 Unreserved Second Class Seating coaches.
  2. Train No. 02935/02936 Bandra Terminus - Surat Superfast Special running with 5 Unreserved Second Class Seating coaches.
  3. Train No. 09135/09136 Valsad - Ahmedabad Special running with 7 Unreserved Second Class Seating coaches.
  4. Train No. 09137/09138 Dahanu Road - Vadodara Superfast Special running with 7 Unreserved Second Class Seating coaches.
  5. Train No. 09129/09130 Valsad - Vadodara Superfast Special running with 5 Unreserved Second Class Seating coaches.
  6. Train No. 09519/09520 Bhavnagar Terminus - Okha Special running with 7 Unreserved Second Class Seating coaches.
  7. Train No. 09339 Dahod - Bhopal Special running with 7 Unreserved Second Class Seating coaches.
  8. Train No. 09323 Dr. Ambedkar Nagar -

Bhopal Special running with 7 Unreserved Second Class Seating coaches.

10. Train No. 09419/09420 Ahmedabad - Somnath Special running with 6 Unreserved Second Class Seating coaches.

Shri Thakur further stated that the passengers with valid Monthly Season Ticket (MST) and unreserved Mail/Express tickets will be permitted to travel in these aforementioned intercity Special Trains by Unreserved Coaches only. They will not be allowed to travel in the reserved coaches of these trains wherein only passengers with valid reserved tickets are permitted. Superfast charges will be applicable in case of Superfast trains. In case of trains originating/terminating in the State of Maharashtra, only fully vaccinated persons as defined by Maharashtra Govt. will be issued Monthly Season Tickets. Presently, Season Tickets are being issued only on monthly basis except in cases of revalidation. The revalidation of non-suburban tickets will be carried out from 29th October, 2021 for the number of days lost as per extant Railway Board instructions and that Season Tickets issued through UTS which were valid from 23rd March, 2020 & onwards during the lockdown period, will be considered for revalidation. Passengers are requested by Western Railway, to adhere to all norms, SOPs related to COVID-19 during boarding, travelling and at the destination.

**Ahmedabad One Mall's Diwali special theme 'Sound of Happiness'**



With the festival of light-Diwali just around the corner, Ahmedabad One Mall is all geared up to give everyone in the city a grand experience of the Sound of Happiness décor and celebrate this day with much fun and fervor. This year at Nexus Malls' portfolio of malls, patrons can also contribute and add to the Sound of Happiness by purchasing bells and adding to a Noble cause. The proceeds from the contribution will directly go to an NGO aiding the kin of those who lost their battle to COVID over the last 18 months. For the festivities this year, Ahmedabad One Mall once again has a unique décor named the Sound of Happiness. Inspired by the majestic bell at temples, through its theme, the mall will bring the feel of spirituality, positivity, and the

blessing of Gods & Goddesses. It is believed that deities remain manifested in temples where bells are rung. The theme will also highlight the interesting significance of each part of the bell. The sound of the bell is considered auspicious which welcomes divinity and dispels evil. The sound of the bell is said to disengage the mind from ongoing thoughts thus making the mind more receptive. Bell ringing during prayer is said to help in controlling the ever-wandering mind and focusing on the deity. -

**ASHISH POLYPLAST LIMITED**  
 CIN: L17110GJ1994PLC021391  
 Registered Office: 501, Fortune Business Hub, Near Satyamev Eysium, Sector 23, Gandhinagar, Ahmedabad-380050  
 Phone(M) : 9099052582, 9825202977  
 Email: ashishpolyplast@gmail.com  
 Website: www.ashishpolyplast.com

**Notice**  
 Notice is hereby given pursuant to Regulation 47(1)(a) that in terms of Regulation 29(1)(a) read with Regulation 33(3)(d) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a Meeting of Board of Directors of the Company is scheduled to be held on Saturday, the **November 13, 2021** at its Registered Office, inter-alia to consider and approve the Unaudited Financial Results for the quarter ended on September 30, 2021.

The Trading windows on the exchange will remain closed for the Director, Key managerial Persons and their Relatives, Promoters and their Relatives till 48 hours after the announcement of financial results to stock exchange. Notice is also available on website of the Company at www.ashishpolyplast.com and also at the Stock Exchange Website at www.bseindia.com .

For Ashish Polyplast Limited  
 Sd/-  
**Ashish D Panchal**  
 Managing Director  
 DIN:00598209

Date: **OCTOBER 29, 2021**  
 Place: **AHMEDABAD**

**SAR AUTO PRODUCTS LIMITED**

Regd. Office : 50-E BHAKTINAGAR INDS ESTATE,RAJKOT 360 001  
 CIN: L34100GJ1987PLC010088  
 Website: www.sarautoproducts.com, Email: sapli@sarautoproducts.com

**Extract of Unaudited Financial Result for the quarter ended on 30th September, 2021**  
 (Rs. in Lacs except per share data)

Sl. No.	Particulars	Quarter Ended				Year Ended			
		30-Sep-21	30-Sep-20	30-Sep-21	30-Sep-20	30-Sep-21	30-Sep-20	31-Mar-21	31-Mar-20
1	Total Income from Operations (Operating)	28.33	4.50	51.35	4.50	51.35	4.50	51.35	4.50
2	Net Profit/(Loss) for the period before Tax, Exceptional and Extraordinary Items	28.33	4.50	51.35	4.50	51.35	4.50	51.35	4.50
3	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and Extraordinary Items)	28.33	4.50	51.35	4.50	51.35	4.50	51.35	4.50
4	Total Comprehensive Income for the period (Comprising profit for the period (after tax) and other comprehensive income (after tax))	28.33	4.50	51.35	4.50	51.35	4.50	51.35	4.50
5	Equity Share Capital	1000	1000	1000	1000	1000	1000	1000	1000
6	Earnings Per Share (of Rs.10/-each) (For continuing and discontinuing operations)	0.28	0.34	0.52	0.28	0.34	0.52	0.28	0.34
1	Basic	0.28	0.34	0.52	0.28	0.34	0.52	0.28	0.34
2	Diluted	0.28	0.34	0.52	0.28	0.34	0.52	0.28	0.34

Notes:  
 a) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity.  
 b) The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.  
 c) - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules /AS Rules, whichever is applicable.

For and on behalf of Board of Director,  
**Ramesh D. Virani**  
 Chairman & Managing Director  
 DIN : 00313236

Place: Rajkot  
 Date: October 29, 2021

**MANAPPURAM HOME FINANCE LIMITED**  
 FORMERLY MANAPPURAM HOME FINANCE PVT LTD  
 CIN: UB9293K12019PIC038175  
 Regd Office : IV-77/A (DLV)W638A/NEW Manappuram House Valapad Thissur, Kerala 685055  
 Corp Office : Manappuram Home Finance Limited, The Fort, Unit No. 501 to 515, A Wing, Yashraj West Street, Andheri-Kurla Road, Andheri East, Mumbai-400093, Maharashtra. Phone No. 022-66211000. Website: www.manappuramhomefin.com

**DEMAND NOTICE**  
 A notice is hereby given that the following borrowers have defaulted in the repayment of principal and interest of the loan facility provided by them from the Company and the loans have been classified as Non-Performing Assets (NPA). The notice dated was issued to them under Section 13 (2) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act-2002 on their last known addresses as provided to the company by them. That in addition thereto for the purposes of information of the said borrowers enumerated below, the said borrowers are being informed by way of this public notice.

Sl. No.	Name of the Borrower/Co-Borrower/ Surety/ Loan Guarantor/ Member/ Kinship	Description of Secured Asset in respect of which interest has been created	HPA Date	Demand Notice Date / & Outstanding Amount
1	Gujeshankar Malikan Sharma, Minaban Gujeshankar Sharma, Sureshbhanarayan Mishra, Sateeshbhanarayan Malikan Sharma/ PUSPOLUN3000000292506/AHMEDABAD	Flat No. 402, Block No. C-38, 4th Floor, Soverainnagar Park, Opp. Laxmi Villa, 2, Nr. Hardardshan Cross Road, Nava Road, Ahmedabad - 380245, Gujarat, INDIA	10-10-2021	16-10-2021 / Rs. 1519461/-

The above borrowers are advised to make the payments of outstanding within period of 60 days from the date of issuance of notice U/s. 13 (2), failing which further steps will be taken after expiry of 60 days from the date of issuance of notice U/s. 13 (2) dated mentioned above as per the provisions of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.

Sd/-  
**Ashutosh Choudhary**  
 Authorized Officer  
 Manappuram Home Finance Ltd

Date : 30-10-2021  
 Place : Gujarat

**Tari Sathe Running Successfully all over the theaters**



Ahmedabad, Bhavya film. Bhavya Gandhi is playing the lead role in this film. He will be seen with actress Jhinal Belani in the Gujarati romantic musical film 'Tari

Saathe'. The film is getting tremendous love from all over the Gujarat. It's the first musical film to be made in Gujarati cinema. It is a sweet love story that was featured in. The film is very interestingly written and amazingly shot. Moreover, the songs are extremely beautiful and I am in love with the songs. Tari Sathe is a Gujarati movie released on 15 Oct, 2021. The movie is directed by Rakesh Shah and featured Bhavya Gandhi and Jhinal Belani as lead characters. Cast & Crew. Rakesh Shah Director. Bhavya Gandhi Actor. (19-10)

**ECS Biztech Limited**  
 CIN: L30007GJ2010PLC063070  
 Registered Office: 802, The First, ECS Corporate House, behind KhoslaBaug, Party Plot, Off. 132 ft, Ring Road, Vastrapur, Ahmedabad 380015  
 Telephone: 898005006; Website: www.ecscorporation.com; Email: secretarial@ecscorporation.com

**REGULATION 47(1)(B) OF SEBI (LODR) REGULATIONS, 2015 EXTRACT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON SEPTEMBER 30, 2021**  
 (In Rupees)

Particulars	Quarter ended		Six month ended		Year Ended
	30/09/2021	30/09/2020	30/09/2021	30/09/2020	
	Un-Audited				Audited
Total Income from Operations	51.35	4.50	51.35	4.50	51.35
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	28.33	4.50	28.33	4.50	28.33
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	28.33	4.50	28.33	4.50	28.33
Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	28.33	4.50	28.33	4.50	28.33
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax))	28.33	4.50	28.33	4.50	28.33
Equity Share Capital	1000	1000	1000	1000	1000
Earnings Per Share Basic earnings / (Loss) per share (Rs.)	0.28	0.15	0.28	0.15	0.28
Diluted earnings / (Loss) per share (Rs.)	0.28	0.15	0.28	0.15	0.28

Notes:  
 1. The above is an extract of the detailed format of Standalone Un-Audited Financial Results for the quarter ended on September 30, 2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone Un-Audited Financial Results for the quarter ended on September 30, 2021, is available on the website of Stock Exchange at www.bseindia.com as well as on the Company's Website at www.ecscorporation.com.  
 2. These Standalone Un-Audited Financial Results have been reviewed by the Audit Committee in its meeting and were approved by the Board of Directors in their meeting held on October 28, 2021.  
 3. The un-audited standalone financial results of the Company for the Quarter ended on September 30, 2021 are in compliance with Indian Accounting Standards (Ind AS) as notified by the Ministry of Corporate Affairs and have been reviewed by the Statutory Auditors of the Company.

For, ECS Biztech Limited  
 Sd/-  
**Vijay M Mandora**  
 Managing Director

Date: **Ahmedabad**  
 October 28, 2021

**VIVANTA INDUSTRIES LIMITED**  
 Regd. Office: 403, Sarthik 2, Opp. Rajpath Club, S. G. Highway, Ahmedabad 380054.  
 Phone: 079 2687 0953, email: business@vivantaindustries.com, www.vivantaindustries.com  
 CIN: L74110GJ2013PLC075393

**EXTRACT OF UNAUDITED/AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH SEPTEMBER, 2021**  
 (Rs. in Lacs except per share data)

Sl. No.	Particulars	Quarter Ended		Six Month Ended	
		30/09/2021 Unaudited	30/06/2021 Unaudited	30/09/2021 Unaudited	31/03/2021 (Audited)
1.	Total Income from Operations	51.35	4.50	55.85	54.52
2.	Net Profit/(Loss) for the period before Tax, Exceptional and/or Extraordinary (Item)	28.33	(11.23)	17.10	(16.36)
3.	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary item)	28.33	33.77	62.10	(16.36)
4.	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary item)	28.33	33.77	62.10	(17.51)
5.	Total Comprehensive Income for the period (Comprising profit for the period (after tax) and other comprehensive income (after tax))	28.33	33.77	62.10	(17.51)
6.	Equity Share Capital	1000	1000	1000	1000
7.	Earnings Per Share (of Rs.10/-each) (For continuing and discontinuing operations)	0.28	0.34	0.62	(0.18)
1.	Basic	0.28	0.34	0.62	(0.18)
2.	Diluted	0.28	0.34	0.62	(0.18)

Notes:  
 1. The results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on October 28, 2021.  
 2. Information on Standalone Financial Results are as follows:

Particulars	Quarter Ended	Six Month Ended	Year Ended
	30/09/2021 Unaudited	30/06/2021 Unaudited	30/09/2021 Unaudited
Total Income	44.69	4.50	36.13
Profit / (Loss) before tax from continuing operation	35.13	36.75	15.20
Profit / (Loss) after tax from continuing operation	00.00	00.00	00.00
Profit / (Loss) before tax from discontinued operation	00.00	00.00	00.00
Profit / (Loss) after tax from discontinued operation	00.00	00.00	00.00

3. The above is an extract of the detailed format of the Standalone and Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results are available on the websites of the Stock Exchanges (www.bseindia.com) and on the Company's website (www.vivantaindustries.com)

For, Vivanta Industries Limited  
 Sd/-  
**Parikh H. A.**  
 DIN: 00027820

Place: Ahmedabad  
 Date: October 28, 2021



